



અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન

નગર વિકાસ ખાતુ, મધ્યસ્થ કચેરી,

મહાનગર સેવા સદન, સરદાર પટેલ ભવન, દાણાપીઠ, અમદાવાદ-૩૮૦૦૦૧. ગુજરાત.

Website:- www.ahmedabadcity.gov.in

અરજી ક્રમાંક :- RZ/20220509/1032

અરજી તા.:- ૦૮/૦૫/૨૦૨૨

પહોંચ નં.:- ૭૩૩/૩૩, તા.:-૦૮/૦૫/૨૦૨૨

અરજદારશ્રી :- જીએશકુમાર,

નિકોલ અમદાવાદ.

ઝોનિંગ સર્ટિફિકેટ

ગુજરાત નગર રચના યોજના અને શહેરી વિકાસ અધિનિયમ- ૧૯૭૬ની કલમ- ૧૭(૧)(ક) હેઠળની જોગવાઈઓ અન્વયે રાજ્ય સરકારશ્રીનાં શહેરી વિકાસ અને શહેરી ગૃહનિર્માણ વિભાગનાં જાહેરનામા ક્રમાંક GH/V/207 OF 2014/ DVP-112013-4777-L, તા.:-૨૦/૧૨/૨૦૧૪થી અમલમાં આવેલ ઔડા દ્વારા તૈયાર થયેલ દ્વિતીય પુનરાવર્તિત વિકાસ યોજના- ૨૦૨૧ મુજબનાં નકશાનાં આધારે.

ટાઉન પ્લાનિંગ સ્કીમ નં. :- ૧૦૨ - નિકોલ (ફાઇનલ)

ફાયનલ પ્લોટ નં. :- ૬૨

રી.ડી.પી. શીટ નં. :- ૯૩

ની જમીન રહેણાંક ઝોન-૧ (એક) R1 માં આવે છે.


નોંધ:-

૧. આ ફક્ત ઝોનિંગ સર્ટિફિકેટ છે. બાંધકામની પરવાનગી નથી.


તારીખ:- ૦૮/૦૫/૨૦૨૨.

ખરી નકલ

જી. ફાફ્ટસમેન


હેડ ફાફ્ટસમેન


ટાઉન પ્લાનિંગ ઇન્સ્પેક્ટર
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન
અમદાવાદ.

PART PLAN OF FINAL TOWN PLANNING SCHEME NO:102 (NIKOL)

Sanctioned Under Urban Development and Urban Housing Department, Government of Gujarat

Notification NO.: - : GHV/120 OF 2019/TPS-112018-7594-L, date: 03/09/2019



FINAL PLOT NO: 62

SCALE 1 cm = 25 MT



This part plan is certified for the F.P NO: 62

Note:- (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered As Development Permission or Permission for Addition/Alteration .

નોંધ:- આ ફક્ત ટી.પી. સ્કીમ મુજબનો પાર્ટ-પ્લાન છે. રોડલાઈનની અસર/ઝોનિંગ વિગેરે બાબતો અંગે રીડીપી મુજબનાં પાર્ટ-પ્લાન/અભિપ્રાય મુજબ વર્તવાનું રહેશે.

અરજદાર દ્વારા ઇ.નં. 20220509/1565 તા. 9/15/22 થી નકલની માંગણી કરેલ હોઈ પહોંચ નં. 733/35 તા. 9/15/22 રૂ. 1000/- વસુલ લઈ નકલ આપવામાં આવેલ છે.

LEGEND

- F.P. BOUNDARY
- ROAD
- T.P.S. BOUNDARY

Prep. By

Chd. By:

H. D' man:

TRUE COPY

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD

PART PLAN SHOWING

F.P. NO.: - 62

T.P.S. NO. & NAME :- 102_NIKOL

DISTRICT:- AHMEDABAD




1 c.m. = 20 mt.

Part plan as per Second Revised Development Plan_2021
Prepared by AUDA and Final sanctioned U/s-17(1)(C) of
the G.T.P. & U.D. Ad-1976 (Presidents act no.27 of 1976.)
by the Urban Development & Urban Housing Department-
Govt. of Gujarat vide its Notification No.GH/V/207
of 2014/DVP-112013-4777-L Dtd.20-12-2014.

LEGEND

- Residential Zone I-R1
- Village Boundary
- TPS Boundary
- Existing Road
- Proposed Road



This part plan is certified for the F.P. NO. : - 62

- NOTE :-** (1) This part plan cannot be used for making any entry in revenue records and can not be considered as any Development Permission.
(2) This Part-Plan is as per RDP-2021. Please refer T.P.Scheme Part-Plan for details of TP Road & Boundary of Final Plot etc.

Application Inward No.: - RP2022.0509/1031
Amount Received Rs. 1000/-
Receipt No. 233/34 Dtd. 09/15/2022.

TRUE COPY

[Signature]
9/5/2022

TOWN PLANNING INSPECTOR
TOWN DEVELOPMENT DEPARTMENT
AHMEDABAD MUNICIPAL CORPORATION
AHMEDABAD.

Prep. By:

Chd. By:

H. D' man:

પુનઃ વહેંચણી અને ક્રિમિનલ આકારણીનું પત્રક

२. जमीन माहिलाओ मुणपंडांना पोतावा हिसावा प्रमाणां वावरांनी २३म दिवानी तथा अंतीमपंडां तेओना हिसावा प्रमाणां काणीनी २३म वरवांनी रद्दये.

06/05/2022

2025/02/05

TRUE COPY
9/15/2022
Town Planning Inspector
Ahmedabad Municipal Corporation
Ahmedabad